

ત્વરિત જાહેરાત માટે

સીટી વરિષ્ઠ રહેવાસીઓ માટે ભાડામુક્ત (ફ્રી ફેર) બ્રેમ્પટન ટ્રાન્ઝિટની શરૂઆત ફેબ્રુઆરી 28 થી કરશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ફેબ્રુઆરી 14, 2022) – ફેબ્રુઆરી 28 થી શરૂ કરીને, બ્રેમ્પટનના વરિષ્ઠ રહેવાસીઓ બ્રેમ્પટન સીનિયર આઈડેન્ટિફિકેશન કાર્ડ અને વાર્ષિક મફત પાસ ધરાવતા PRESTO કાર્ડથી બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં મફતમાં સવારી કરી શકે છે.

વર્ષ 2020 નાં અંદાજપત્રમાં મંજૂર થયા પ્રમાણે, મફત વાર્ષિક પાસ બ્રેમ્પટનના વરિષ્ઠ નાગરિકોને બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં કોઈ ખર્ચ વગર અસીમિત પ્રવાસ પૂરો પાડશે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ હવેથી \$15 નો સીનિયર રેસિડન્ટ માસિક પાસ વેચશે નહિ અથવા વરિષ્ઠ રહેવાસીને \$1 રોકડ ભાડું આપશે નહીં. બધાં બિન-રહેવાસી (બ્રેમ્પટનમાં ન રહેતા) વરિષ્ઠ નાગરિકો પોતાના PRESTO કાર્ડનો ઉપયોગ કરવાનું અને સીનિયર ઈ-પર્સ ફ્રી \$1.60 ચૂકવવાનું ચાલુ રાખી શકે છે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ વ્યાજબી અને કાયમી પરિવહન પૂરું પાડવા કટિબદ્ધ છે. બ્રેમ્પટનના વરિષ્ઠ નાગરિકો માટે મફત બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પાસથી કાઉન્સિલની અગ્રતાની પરિભાષાને વેગ મળે છે અને બ્રેમ્પટનમાં વરિષ્ઠ નાગરિકો માટે ટ્રાન્ઝિટની પહોંચ સુધારે છે.

આ મફત પાસ સપ્ટેમ્બર 2019 માં રજૂ થયેલ \$15 નાં સીનિયર રેસિડન્ટ માસિક પાસ પછી આવ્યો છે, જેના પરિણામે વરિષ્ઠ નાગરિકો દ્વારા બ્રેમ્પટન સીનિયર આઈડેન્ટિફિકેશન કાર્ડ મેળવવામાં વધારો થયો છે.

પાત્રતા અને તમારા કાર્ડ્સ ક્યાંથી મેળવવા તે અંગે વિગતો માટે વેબસાઈટ જુઓ, www.bramptontransit.com અથવા 905.874.5120 નંબર પર કૉલ કરો.

અવતરણો (ક્વોટ્સ):

“અમે ફેબ્રુઆરી 28, 2022 થી બ્રેમ્પટનના વરિષ્ઠ રહેવાસીઓ માટે મફત ટ્રાન્ઝિટ શરૂ કરવામાં ગૌરવ અનુભવીએ છીએ. આ ટ્રાન્ઝિટ આપણાં વરિષ્ઠ રહેવાસીઓને પરવડી શકવામાં અને તેઓ માટે સંભાળ લેવામાં સીમાચિહ્નરૂપ છે. બ્રેમ્પટન એક હરિયાળુ શહેર છે, અને અમારી 2040 ની યોજનાના ભાગરૂપે અમે આપણાં બ્રેમ્પટન ટ્રાન્ઝિટ નેટવર્ક મારફતે કાર્યક્ષમ, પરવડી શકે તેવું અને કાયમી ટ્રાન્ઝિટ પૂરું પાડવા કટિબદ્ધ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન સીટી કાઉન્સિલે 2020 નાં અંદાજપત્રના ભાગરૂપે બ્રેમ્પટનના વરિષ્ઠ નાગરિકો માટે બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ભાડામુક્ત પ્રવાસને મંજૂરી આપી, અને તે કટિબદ્ધતા આ વર્ષે જીવંત બની છે. હું આપણાં વરિષ્ઠ નાગરિકોને મફત ટ્રાન્ઝિટનો આનંદ માણવા અને ભાડામુક્ત પાસ વડે સક્રિય જીવન જીવવા પ્રોત્સાહિત કરું છું. એક બંધબેસતી વાત એ છે કે આપણાં સમુદાયને બનાવનાર વરિષ્ઠ નાગરિકોને ટ્રાન્ઝિટ પર વિરામ મળે છે.”

- પૉલ વિસેન્ટ (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; અધ્યક્ષ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન સીટી કાઉન્સિલ શહેરમાં ઉત્પન્ન થતા ગ્રીનહાઉસ ગેસનો સ્ત્રાવ વર્ષ 2050 સુધીમાં 80% જેટલો ઘટાડવાના લક્ષ્ય પર છે. અમે આપણાં શહેરમાં પરિવહનના બધાં સ્વરૂપો એકસરખા કરવા કાર્ય કરી રહ્યાં છીએ ત્યારે, બ્રેમ્પટનના વરિષ્ઠ નાગરિકોને ભાડામુક્ત પ્રવાસ કરાવવાની તૈયારી બતાવવી એ પરવડી શકતી અને કાયમી ટ્રાન્ઝિટમાં અને બ્રેમ્પટનના આબોલવામાં ફેરફારને આગળ વધારવાના લક્ષ્યોને ચલિત કરવામાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”

- ડગ વ્હિલ્લન્સ (Doug Whillans), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6; સભ્ય, એન્વાયરોન્મેન્ટ એડ્વાઈઝરી કમિટી; સભ્ય, CEERP કમ્યુનિટી ટાસ્ક ફોર્સ, સીટી ઓફ બ્રેમ્પટન

“અમે શહેરની આસપાસ લોકોની અવરજવર કાર્યક્ષમ રીતે ચાલુ રાખીએ છીએ ત્યારે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ આપણી ટ્રાન્ઝિટ સિસ્ટમમાં સતત અને એકરૂપ સુધારાઓ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ માટે આ વર્ષ મહત્વનું છે કારણ કે અમે બ્રેમ્પટનવાસી વરિષ્ઠ નાગરિકો માટે ભાડામુક્ત પ્રવાસ અમલમાં મૂકી રહ્યાં છીએ અને આપણાં રસ્તાઓ પર ઈલેક્ટ્રિક બસો જોવાનું ચાલુ રાખીએ છીએ.”

- એલેક્સ મિલોજેવિચ (Alex Milojevic), જનરલ મેનેજર, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca